

SARDAR PATEL UNIVERSITY
B Com (III Semester) Examination
Thursday, 6th December 2012
10.30 am to 12.30 pm
UB03ECOM02 / 14 : Advance Accounting and Auditing VI

કુલ ગુણ : ૬૦

- પ્ર. ૧ ઓડિટીંગ એટલે શું? ઓડિટીંગના લક્ષણો અને કાર્યક્ષેત્રની ચર્ચા કરો. (૧૫)
અથવા
પ્ર. ૧ ઓડિટીંગના હેતુઓની વિસ્તૃત ચર્ચા કરો. (૧૫)
- પ્ર. ૨ ઓડિટના પ્રકારોની ચર્ચા કરો. નવુ ઓડિટ શરૂ કરતા પહેલાં શું તૈયારીઓ જરૂરી છે? (૧૫)
અથવા
પ્ર. ૨ ઓડિટ કાર્યક્રમ એટલે શું? ઓડિટ કાર્યક્રમના લાભો અને મર્યાદાની ચર્ચા કરો. (૧૫)
- પ્ર. ૩ આંતરિક તપાસના લક્ષણો અને હેતુઓની ચર્ચા કરો. (૧૫)
અથવા
પ્ર. ૩ અન્વેષણ એટલે શું? ચાલુ ધંધો ખરીદવા મટો અન્વેષણનું કાર્યક્ષેત્ર શું છે? (૧૫)
- પ્ર. ૪ વાઉચીંગ એટલે શું? ઉધાર વેચાણ અને મૂડી ખર્ચની ચૂકવણી માટેના વાઉચીંગની ચર્ચા કરો. (૧૫)
અથવા
પ્ર. ૪ વાઉચીંગનું મહત્વ સમજાવો અને સારા વાઉચરના અંશો લખી સમજાવો. (૧૫)

